GHCL Limited



April 20, 2024

चैत्र – शुक्ल पक्ष, द्वादशी विक्रम सम्वत २०८१

National Stock Exchange of India Limited

"Exchange Plaza" Bandra – Kurla Complex, Bandra (E), Mumbai – 400 051

NSE Code: GHCL

BSE Limited

Corporate Relationship Department, 1st Floor, New Trading Ring, Rotunda Building, P.J. Towers,

Dalal Street, Fort, Mumbai – 400 001

BSE Code: 500171

Dear Sir / Madam,

<u>Sub: Filing of Published copy of Advertisement released for transfer of equity shares</u> to IEPF

Pursuant to Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015 ("SEBI Regulations"), we enclose herewith copy of notice published in The Hindu - Business Line (English) dated April 30, 2024, The Economics Times (English) - Ahmedabad edition April 30, 2024 and Financial Express (Gujarati) dated April 30, 2024, as required under IEPF Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, inviting attention of concerned shareholders to submit their claims in respect of unclaimed dividends of the company for last seven consecutive years failing which their shares would be transferred to IEPF Authority in accordance with Section 124(6) of the Companies Act, 2013 and rules made thereunder.

Copy of this notice shall also be available on the website of BSE Limited (www.bseindia.com/corporates), National Stock Exchange of India Limited (www.nseindia.com/corporates) and on the website of the Company (https://www.ghcl.co.in)

You are requested to kindly take note of the same and please also take suitable action for dissemination of this information.

Thanking you

Yours faithfully

For GHCL Limited

Bhuwneshwar Mishra
VP-Sustainability & Company Secretary

Membership No.: F5330

B- 38, GHCL House, Institutional Area, Sector- 1, Noida, (U.P.) - 201301, India. Ph.: +91-120-2535335, 4939900, Fax: +91-120-2535209 CIN: L24100GJ1983PLC006513, E-mail: ghclinfo@ghcl.co.in, Website: www.ghcl.co.in

04-05 JULY 2024


Dedicated Exhibition For: Drone & Anti-Drone System, Unmanned Systems, LiDAR, Geospatial, Air Taxi & Drone Components.

ecplaza TECHNOLOGY W MENANDO OF CETENCIECO

For more details contact us

India's Only

$m{MUTUAL\ FUNDS\ NAVs}$ Here's a ready reckoner to track the day-on-day changes in your equity and balanced fund portfolio



Notice is hereby given to the Shareholders of the Company pursuant to the provisions of Section 124(6) of the Companies Act, 2013 read with investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 'the Rules') that the Company is required to transfer the shares in respect of which dividend remains unpaid or unclaimed for a period of seven consecutive years, to the IEPF Account established by the Central Government, Hence, at the underlying equity Shares in respect of which dividend has not been paid or caliend for last seven consecutive years from the financial year 2016-17 (Final), have to be transferred to the IEPF Authority as ner satisf fulses.

sax series Collecture years into the limitation year 2,01-17 (rings), are to be transferred to the CFF Authority set. As per the said Rules, the Company had sent a communication dated April 23, 2024 to the concerned shareholders officially at their ablest available address, who did not claimed the Dividends for seven consecutive years starting from financial year 2016-17 and whose shares were liable to be transferred to IEPF, requesting them to claim to be seams. The Company had also uploaded the details of the shareholders whose shares were liable to be transferred to IEPF on its weeksite viz. www.gmb.com. in the claims of the shareholders whose shares were liable to be transferred to IFPF on the second of the IEPF Authority. The original share certificate(s) registered in your name and held by you will stand automatically cancelled and be deemed non-negotiable. In case of shares their of insection form: The shares shall be debited to your Dental account and will be transferred to IEPFs Dental account. Notice is hearby them given that in absence of receipt of a valid claim by the shareholders till June 15, 2024, the Company will transfer said shares to IEPF Account without further notice in accordance with the requirement of said Rules.

said Rules.

Please note that no claim shall is equient the Company in respect of the unclaimed Dividend amount and shares transferred to IEPF pursuant to the said Rules. On transfer of the Dividend and the shares to IEPF, the Shareholders may claim the same by making an application to IEEPF in Porm IEPF-8 as per the IEPF Rules. The said form is available on the Company's website and website of IEPF viz. www.lepf.gov.in.

In case the startednoise have any quaries on the subject malate and the Rules, they may contact to the Company's Registers and Share Transfer Aperts, NIs Link Intrine India Pxt. LLL, Unit-GPLC. LLIMING. Col. 12, 479 Pxt. L.B. S. Marp, Widney (West), Mumbai-400.08, Tol. 19-102-2-8108116767, Fax: 1-91.022-40180000; E.Mail: ispf.shares@linklinims.col.

chip Eqty 062:91

0.01 Very Cautious 642.19

ફોર્મ નં.-ચુઆરસી-૨

અધિનિયમના XXI પ્રકરણના ભાગ I હેઠળ નોંધણી વિશે સૂચના આપતી નોટિસ કંપની અધિનિયમ, 2013 ની કલમ 374(બી) અને કંપની (નોંધણી માટે અધિકૃત) નિયમો,

2014ના નિયમ 4(1) ને અનુસરીને] આથી સૂચના આપવામાં આવે છે કે કંપની એક્ટ ૨૦૧૩ની કલમ ૩૬૬ની પેટા કલમ (૨)ના અનુસંધાનમાં, અહીંથી પંદર દિવસ પછી પરંતુ ત્યાર પછીના ત્રીસ દિવસની મુદત પૂરી થાય તે પહેલા **સેન્ટ્રલ રજીસ્ટ્રેશન નોંધણી કેન્દ્ર** (सि.आ२.सि.), ईन्डियन ईन्टिट्यूट ओફ કોર્પોરેટ અફેર્સ (આઇ. આઇ. સિ. એ.) પ્લોટ નંબર ૬, ७, ૮, સેક્ટર ૫, આઈ.એમ ટિ. માનેસર, જિલ્લો ગુડગાંવ (હરિયાણા) પિનકોડ-૧૨૨૦૫૦ માં "મે. સિવિલ ટેક વેરીટસ" એક ભાગીદારી એક્ટ ૨૦૧૩ ના ચેપ્ટર XXI ના ભાગ I હેઠળ શે૨ દ્વારા મર્યાદિત

કંપની તરીકે અરજી કરવાની દરખાસ્ત મુકી છે. કંપનીના મુખ્ય હેતુઓની નીચે મુજબ છે : મિકેનિકલ, કેમિકલ અને સિવિલ ટેસ્ટિંગ વેગે भेवाओ भदित तभाभ प्रधारनी इन्भट्टन्भी अन મટિરિયલ ટેસ્ટિંગ પ્રદાન કરવાનો વ્યવસાય હાથ ધરવો તેમજ સિવિલ, ઈન્કાસ્ટક્ચર વગેરેના સંબંઘમાં સંબંધિત સહાયક પ્રવત્તિઓ/કાર્ય હાથ ધરવું, આર્કિટેક્ચરલ અને સુપરવિઝન કાર્ય સહિત પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટસી સેવાઓ પ્રદાન કરવી અને સિવિલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ટર્ન પ્રોજેક્ટ્સની સ્થાપના હાથ ધરવી અને તેમાં આકસ્મિક અન્ય કોઈપણ પ્રવૃત્તિઓ કરવી. 3.સૂચિત કંપનીના ડ્રાફ્ટ મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ની નકલ **૪૯,** ૬૦, શ્રી રંગ સોસાચટી, પાલનપુર પાટીચા,

રાંદેર રોડ, સુરત, ગુજરાત-૩૯૫૦૦૫. ખા તેની ઓફિસમાં તપાસવામાં આવી શકે છે. . આથી સૂચના આપવામાં આવે છે કે આ અરજી સામે વાંધો ઉઠાવનાર કોઈપણ વ્યક્તિ પોતાનો વાંધો સેન્ટ્રલ રજીસ્ટ્રેશન સેન્ટર (સિ. આર સિ.), ઈન્ડિયન ઈન્ટિટ્યૂટ ઓફ કોર્પોરેટ અફેર્સ (આઈ. આઈ. સિ. એ.), પ્લોટ નંબર ૬, ૭, ૮ સેક્ટર પ. આઈ.એમ.ટિ. માનેસર, જિલ્લો ગુડગાંવ (હરિયાણા), પિનકોડ-૧૨૨૦૫૦. આ નોટિસના પ્રકાશનની તારીખથી એકવીસ દિવસની અંદર. કંપનીને રજિસ્ટર્ડ ઓફિસમાં એક નકલ સાથે લેખિતમાં જણાવી શકે છે.

> મે. સિવિલ ટેક વેરીટસ સહી/

અરજદારનું ના ૧. રણછોડભાઈ વિરજીભાઈ પ્રજાપતિ (ભાગીદાર ૨. પુષ્પાબેન રણછોડભાઈ પ્રજાપતિ (ભાગીદાર) . પ્રશાંતકુમાર અનિલકુપમાર જયસ્વાલ (ભાગીદાર ૪. નીતિન નારાચણ કલકર્ણી (ભાગીદાર નારીખ : ૩૦ એપ્રિલ, ૨૦૨૪ | સ્થળ : સુરત

Form No. INC-25A

Before the (Central Government) Region Director, Ministry of Corporate Affairs

In the matter of the Companies Act, 2013, section 14 of Companies Act, 2013 and rule 41 of the Companies (Incorporation) Rules, 2014 AND

In the matter of M/s. Partap Extractions Limited having its registered office at VIII.Nasirpur, Hisar Road, Ambala City Haryana 134003, having CIN no. U15142HR1986PLC025676

Notice is hereby given to the general public that the company intending to make an application to the Central Government under section 14 of the Companies Act, 2013 read with aforesaid rules and is desirous of converting into a private limited company in terms of the special resolution passed at the Extra Ordinary General Meeting held on 30.03.2024 to enab the company to give effect for such conversion Any person whose interest is likely to be affected

by the proposed change/status of the company may deliver or cause to be delivered or send by registered post of his objections supported by an affidavit stating the nature of his interes and grounds of opposition to the concerned Regional Director , Northern Region B-2 Wing, 2nd floor, Pt. Deendayal Antyodaya Bhawar 2nd floor, CGO Complex, New Delhi-110003 within fourteen days from the date of publication of this notice with a copy to the applican company at its registered office at the address ntioned below

Registered Office: Partap Extractions Limited, Vill. Nasirpur. Hisar Road. Ambala City Haryana-134003

For Partap Extractions Limited Place: Ambala City Gautam Bansa Date: 30th April 2024 DIN: 02275574

helios **NOTICE NO.9/2024**

Disclosure of unaudited half-yearly financial results of the schemes of Helios Mutual Fund

Notice is hereby given to the investor(s)/ Unit holder(s) of all the schemes of Helios Mutual Fund (the 'Fund') that in accordance with Regulation 59 of Securities and Exchange Board of India (Mutual Funds) Regulations, 1996 read with Paragraph 5.3 of SEBI Master Circular for Mutual Funds SEBI/HO/IMD/IMD-PoD-1/P/ CIR/2023/74 dated May 19, 2023, the Half Yearly Unaudited Financial Results of all the schemes of the Fund for the half year ended March 31, 2024 has been hosted on the website of the Fund viz. https://www.heliosmf.in/downloads/

Investors may accordingly view/download the results of the schemes of the Fund from the website.

For Helios Capital Asset Management (India) Private Limited (Investment Manager to Helios Mutual Fund)

Sd/-

Date : April 29, 2024 Place : Mumbai

Authorised Signatory Mutual Fund investments are subject to market risks, read

all scheme related documents carefully. Helios Capital Asset Management (India) Private Limited (Formerly Helios Capital Management (India) Private Limited). Registered Office: 515 A, 5th Floor, The Capital, Plot C70, Bandra Kurla Complex, Bandra East, Mumbai - 400051, Maharashtra. Corporate Office: 502, B Wing, The Capital, Plot C70, Bandra Kurla Complex, Bandra (East), Mumbai - 400051, Maharashtra.

Contact: 022-67319600, Website: www.heliosmf.in. Corporate Identification Number (CIN): U67190MH2021PTC360838

Remus - रीमस झार्मास्युटीङस्स विमीटेड

રજી. ઓફિસ : ૧૧૦૧ થી ૧૧૦૩, સાઉથ ટાવર, વન ૪૨, અશોક વાટિકાની પાછળ, જચંતિલાલ પાર્ક બીઆરટીએસ પાસે, આંબલી બોપલ રોડ, અમદાવાદ - ૩૮૦૦૫૪, ગુજરાત, ભારત ા ટેલીફોન : +079-2999 9857 વેબસાઈટ : https://remuspharma.com ા ઈ-મેલ : cs@remuspharma.com

એક્સ્ટ્રા ઓર્ડનરી જનરલ મીટીંગની નોટિસ

રીમસ કાર્માસ્થટિકલ્સ લિમિટેડની એક્સ્ટા ઓર્ડનરી જનરલ મીટીંગ (ઇજાએમ) માટે નોટિસ માપવામાં આવે છે કે આ એક્સ્ટ્રા ઓર્ડનરી જનરલ મીટીંગ મંગળવાર તા. ૨૧ મે, ૨૦૨૪ના રો૧ ભારતીય સમય અનુસાર સવારેના ૧૧.૩૦ કલાકે વિડીયો કોન્ફરન્સિંગ (વીસી)/અન્ય ઓડિયો વિઝચુઅલ રીતે (ઓએવીએમ) દ્વારા કંપનીઝ એક્ટ, ૨૦૧૩ની તમામ જોગવાઇઓ લાગુ પડે તે રીતે અને કોર્પોરેટ અર્ફર્સ મંત્રાલય (એમસીએ) અનુસાર તા. ૮ એપ્રિલ , ૨૦૨૦ , ૧૩ એપ્રિલ , ૨૦૨૦ , ૫ મે , ૨૦૨૦, ૧૩ જાન્યુઆરી, ૨૦૨૧, ૮ ડિસેમ્બર ૨૦૨૧, ૧૪ ડિસેમ્બર ૨૦૨૧, ૫ મે ૨૦૨૨ અને ૨૮ ડિસેમ્બર, ૨૦૨૨ તથા સેબી સર્ક્યુલર્સ તા. ૧૨ મે ૨૦૨૦, ૧૫ જાન્યુઆરી ૨૦૨૧ અને ૧૩ મે ૨૦૨૨ ('સર્ક્યુલર્સ' તરીકે એકબ્રિત) અનુસાર નોટીસમાં દર્શાવેલ વ્યવસાયોનો વ્યવહાર કરવા માટે ઇજીએમ નોટિસમાં જણાવ્યા અનુસાર સભ્યોનો સામાન્ય સ્થળે હાજરી વિના અને કંપની દ્વારા ઇલેક્ટ્રોનિક મોડમાં જ યોજવામાં આવશે. તદ્અનુસાર, કંપનીની ઈજીએમની નોટીસ જે સભ્યોએ તેમના ઈ-મેલ આઈડી ડીપોઝટરીઓ અથવા કંપની પાસે રજીસ્ટર્ડ કરાવેલ છે તેમની ઈલેક્ટ્રોનીક પધ્ધતિ મારફત મોકલેલ છે. ઇજીએમ માટેની નોટિસની ફિઝિકલ કોપી એમસીએ સર્ક્યુલર્સની જોગવાઇ અને સેબી સર્ક્યુલરની જોગવાઇ અનુસાર મોકલવામાં આવી નથી. ઇજીએમની નોટિંસ સાથે ઇ-વોટિંગ માટેની સૂચનાઓ તે કંપનીની વેબસાઇટ www.remuspharma.com પર ઉપલબ્ધ રહેશે અને સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ NSE Limited https://www.nseindia.com/ પરથી મળશે.

કંપનીઝ એક્ટ ૨૦૧૩ના સેક્શન ૧૦૮ની જોગવાઇ અને તેની સાથે કંપનીઝ, (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રુલ્સ, ૨૦૧૪ના રુલ ૨૦ને વાંચતા તથા સેબીના ૪૪મા રેગ્યુલેશન (भ) जिन्नेशन्स सेन्ड डिस्ड्लोजर रीडवायर्मेन्ट्सनी नोंधणी) रेग्युलेशन्स, २०१५ सन સામાન્ય મીટિંગ્સ પરના સેક્રેટરિયલ સ્ટાન્ડડર્સ (એસએસ-૨) અંગે ઇન્સ્ટિટ્યટ ઓક કંપની સેક્રેટરિયન્સ ઓફ ઇન્ડિયા દ્વારા ઇસ્થૂ કરવામાં આવેલ છે, તે સભ્યોને તમામ સુવિધા પ્રદાન કરવામાં આવશે જેથી તેઓ તેમના મત તમામ નિર્ણચાત્મક રીતે ઇજીએમની નોટિસમાં જણાવ્યા મુજબ ઇલેક્ટ્રોનિંગ વોટિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને ઇજીએમના સ્થળે ગયા વિના અન્ય રીતે ું (રીમોટ ઇ-વોટિંગ) દ્વારા આપી શકે. કંપનીએ લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાઇને અધિકૃત એજન્સી તરીકે ઇ-વોટિંગની સુવિધા તમામ સભ્યોને પૂરી પાડી છે. જે સભ્યો પાસે ફિઝિકલ રૂપે અથવા ડીમટીરિચલાઇઝ્ડ રૂપે કટ ઓફ તારીખ ૧૪ મે , ૨૦૨૪ ના શેર ધરાવતા હોય તેઓ રીમોટ ઈવોટીંગથી વોટ આપી શક્શે.

રીમોટ ઇ-વોટિંગ સમયગાળો શનિવાર ૧૮ મે, ૨૦૨૪ના રોજ સવારે ૯.૦૦ ક્લાકથી શરૂ થશે અને સોમવા૨, ૨૦ મે, ૨૦૨૪ની સાંજનાં ૫.૦૦ ક્લાક સુધીનો ૨હેશે. રીમોટ ઇ-વોટિંગ કથિત તારીખ અને સમય પછી કરી સકાશે નહીં. રીમોટ ઇ-વોટિંગ સંબંધિત અન્ય વિગતો માતે ઇજીએમની નોટિસ જોવી. ઇ-વોટિંગ અંગેની વધુ તપાસ અથવા બાબતો માટે તેઓ ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ (એફ્એક્ચૂસ) અને ઇ-વોર્ટિંગ મેન્યુઅલ જે Instavote-Linkintime પર ઉપલબ્ધ છે તે જોઇ લેવા અથવા ઇ-મેઇલ કરો enotices@linkintime.co.in અથવા કોલ કરો ૦૨૨-૪૯૧૮૬૦૦૦ . ઇજાએમમાં હાજર સંબંધિત મુદ્દાઓ તથા વધુ જાણકારી માટે તમે અત્રે આપેલી વેબસાઇટ પર ઇ-મેઇલ કરી શકો છો : instameet@linkintime.co.in અથવા કોલ કરો ૦૨૨-

४८१८६१७५ સભ્યોએ નોંધ લેવી કે :

- એ. ઇ-વોટિંગ દ્વારા ઇજીએમ ખાતે વોટ આપવા માટેની સુવિધા ઇજીએમ ખાતે પણ ઉપલબ્ધ રહેશે અને સભ્યો જે ઇજીએમમાં હાજર રહેશે જેમણે પોતાના વોટ રીમોટ ઇ-વોટિંગ દ્વારા ન આપ્યા હોય તેઓ ઇજીએમના સમયે ઇ-વોટિંગ દ્વારા વોટ આપી શકશે.
- **બી.** જે સભ્યોએ ઇજીએમમાં અગાઉથી રીમોટ ઇ-વોટિંગ દ્વારા વોટ આપી દીધા હોય તેઓ ઇજીએમમાં વીસી/ઓએવીએમ દ્વારા હાજર રહી સકે/ભાગ લઇ શકે છે, પરંતુ તેઓ ફરીથી વોટ આપી શકશે નહીં.
- સી. જે વ્યક્તિનં નામ સભ્યોના રજિસ્ટરમાં નોંધાયેલ હશે અથવા બેનિકિશિયલ ઓનર્સ જે ડિપોઝિટરીઝ દ્વારા જળવાચેલ હશે તેઓ કટ-ઓફ તારીખ પર માત્ર રીમોટ ઇ-વોટિંગ તેમ જ ઇજાએમ ખાતે ઇ-વોટિંગ દ્વારા વોટ આપી શકશે.
- **ડી.** જે સભ્યોના ઇ-મેઇલ એડ્રેસ ડિપોઝિટરી ભાગીદાર સાથે રજિસ્ટર્ડ/અપડેટેડ નથી તેઓ ડિપોઝિટરી ભાગીદારની માફક જ તેમના ડીમેટ એકાઉન્ટ્સની જાળવણી કરવા માટે વિનંતી કરી શકશે.
- કોઇ પણ વ્યક્તિ જેની પાસે શેર્સ હોય અને જે નોટિસ મોક્ત્યા પછી કંપનીના સભ્ય બન્ય હોય તથા કટ-ઓફ તારીખ પર શેર્સ ધરાવતા હોય તેઓ ઇજીએમની નોટિસની કોપી ઇલેક્ટ્રોનિક દ્વારા મેળવવા કંપનીને અથવા કંપનીના આરટીએને વિનંતી કરી શકે છે.

બોર્ડના આદેશ દ્વારા રીમસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ માટે દેવલ પટેલ ક્થળ : અમદાવાદ તારીખ : ૨૯.૦૪.૨૦૨૪ કંપની સેક્રેટરી અને કમ્પલાયન્સ ઓકિસ

કળજા નોટીસ (સ્થાવર મિલકત માટે) નિયમ ૮ (૧)

એસેટસ અને એન્કોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્કોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ્ ળતરૂત અંજ અજનાનનાટ આફ તારાવાદાદા અન્દરન્ટ આત્ર કરોને હાંચાના તારાવાદાદા અન્દરન્ટ (અજનાન્યન નાચાના, અંગ્યના માઇ 3 સાથે ત્યાંતા કિલમ ૧૩ (૧૨) હેઠળ મળતી સત્તાનો ઉપયોગ કરીને કંપનીના અધિકૃત અધિકારી ફારા અહીં નોંચે ભાવોલ દેવાદારો/મહ-દેવાદારોએ માંગણા મોટીસ જારી કરી નોટીસમાં જણાવેલ ટકમ જણાવેલ મોટીસ મળ્યાની તારીખર્ચી ૬૦ દિવસની એક્ટર ચુકવવા જણાવ્યું હતું, દેવાદારો ટકમની પારત ચુકવાથી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી નીચે સહી કરનારે જણાવેલ નિચમોના નિચમ ૮ સાથે વંચાતી જણાવેલ એક્ટની કલમ ૧૩(૪) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને નીચે જણાવેલ મિલકતની કબજો લઇ લીઘો છે. ખાસ કરીને દેવાદાર અને જાહેર જ્વાતા મે મિલકત સાથે કોઇ સોદો न हरता आवध हरतामां आवे छे अने मिवहत आशेनी होत्ताग ओही आधरआधरोह हमेव सेशग्रे हमेवनी अही नीशे जगावेव रहम अने तेन ા કરવા દાવાન કરવાના આવે છે છેવા ભેતારા દાવાના કાઇલા દાશા આઠળાઇંગ્રેગલા અધ્યાગ છેવાના છો. ત્યાં મહાવાન કરન ગળ ત કરના ત્યાંજના ચાર્જને આદિન રહેશે. એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ / ની જોગલાઇજો પ્રત્યે દેવાદારોનું દયાન દોરવામાં ઓલે જે દેવાદારો શાઇઆઇએફએલ એચએફએલની બાકી રકમ તેમજ લાગુ તમામ કોસ્ટ, ચાર્જઅને ખર્સની રકમ, વેચાણ અને ટ્રાન્સફરની તારીખ પહેલા કોઇપણ સમયે પતાવટ કરે છે, તો સિક્ચોર્ડ એસેટ્સનું આઇઆઇએફએલ એચએફએલ દ્વારા વેચાણ અથવા તબદીલી કરવામાં આવશે નહી અને

આઇઓઇએક્એલ એચએક્એલ દ્વારા સિક્ચાંડ એસટ્સના વચાણ એને ટ્રાન્સફર માટે કોઇ પંગલા લેવામાં આવેશ નહીં.							
દેવાદાર(રો)/ સહ–દેવાદાર(રો)નું નામ	સિક્યોર્ડ એસેટ્સની વિગત (સ્થાવર મિલકત)	કુલ બાકી રકમ (રૂા.) માં	માંગણા નોટીસની	કળજાની તારીખ			
શ્રી જગદિશભાઇ રાઠોડ, શ્રીમતી	મિલકત નં. ૧૨૧/૮૮એ, ગામ–૫૨વત, લિંગાડા,	રૂા. ૪૧૭૮૪૬/–	તારીખ	CITETOL			
રેખાબેન રાઠોડ, શ્રીમતી રેવાબેન		(રૂપિયા ચાર લાખ	૨૪/૦૧/	२६/०४/			
રાઠોડ, મિલ્ક ઇન્કમ જગદિશભાઇ	ખાતેની મિલકતના તમામ ભાગ અને હિસ્સા. એરિયા ક્ષેત્રફળ (ચો. કૂટ),મિલકતનો પ્રકાર : જમીન એરિયા,	સત્તર હજાર આઠસો	5058	5058			
રાઠોડ	કાર્પેટ એરિયા. બિલ્ટ અપ એરિયા. મિલકત એરિયા :	છેતાલીસ પુરા)					
પ્રોસ્પેક્ટ નં.આઈએલ૧૦૩૫૨૭૮૫	८८०.००, ६३०.००, ७५९.२०						
વધુ વિગતો માટે શાખા ઓફીસના અધિકૃત અધિકારીનો સંપર્ક કરવા વિનંતી છે : શાખા ઓફીસ: પહેલો માળ, શૌર્યા બિલ્ડીંગ, સેન્ટ્રલ બેંક સા મ્ બેંક ઓફ ઇન્ડિયા, કોસ્મોસ બેંક ઉપર, માયફેર રોડ, આણંદ-3૮૮૦૦૧ / અથવા કોર્પોરેટ ઓફીસ: પ્લોટ નં. ૯૮, ફેઝ-૪, ઉદ્યોગ વિહાર, ગુરગૉલ્							

YES BANK રજીસ્ટર્ડ એન્ડ કોર્પોરેટ ઓફીસ : ચશ બેંક લીમીટેડ, ચશ બેંક હાઉસ, ઓફ વેસ્ટર્ન અકસપ્રેસ હાઈવે, સાન્તાક્રુઝ ઈસ્ટર, મુંબઈ ૪૧૬ માર્ગ કે કોર્પોરેટ ઓફીસ : ચશ બેંક લીમીટેડ, ચશ બેંક હાઉસ, ઓફ વેસ્ટર્ન અકસપ્રેસ હાઈવે, સાન્તાક્રુઝ ઈસ્ટર, મુંબઈ

स्थावर भिलङतोना वेचाए। माटे वेचाए। नोटीस

સિક્યુરીટાর্চ্যাগল એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોરમિન્ટ ઓફ સિક્યુરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, २००२ હેઠળ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો ૨૦૦૨ ના રૂલ ૮(૬) ની જોગવાઈઓ વંચાણે લેતા સ્થાવર મિલકતો માટે ઈ-હરાજી થી વેચાણની નોટીસ. આથી ખાસ કરીને ઉદ્યારકર્તા(ઓ), સહ-ઉદ્યારકર્તાઓ, જામીનદારો અને ગિરવેદારો તેમજ સામાન્ય રીતે જાહેર જનતાને નોટીસ આપી જણાવવાનું કે નીચે જણાવેલ સ્થાવર મિલકત જે મુકરર લ્હેણદારને ગિરવે મુકેલ/તારણમાં મુકેલ છે જેનો **પ્રત્યક્ષ કબજો** યશ બેંક લી. મુકરર લ્હેણદારના અધિકૃત અધિકારીએ લીધેલ છે, તે "જેવું છે જયાં છે", "જે છે તે છે" અને "જે છે ત્યાં છે" ના ધોરણે તા. ૨૦.૦૫.૨૦૨૪ ના રોજ નીચે દર્શાવેલ ઉધારકર્તા સહ-ઉદ્યારકર્તા, જામીનદારો અને ગિરવેદારો જામીનદાર પાસેથી નીચે દર્શાવેલ બાકી લેણા કરાર દરે વ્યાજ અને ચાર્જાસ વસુલ કરવા વેચાણ કરાશે.

અ. નં.	ઉધારકર્તા / સહ-ઉધારકર્તા / જામીનદારોના નામ	કિમાન્ડ નોટિસ રકમ	સ્થાવર મિલકતની વિગતો	અનામત કિંમત અને ઈએમડી (રૂા. માં)
۹.	(૧) મે. એમસ્લ્ડ કાર્સ પ્રા. લી. લતી ડિરેક્ટર શ્રી કનેંચી મનલસ્કુમાર ઠક્કર (ઉદાારકતાં) અને, (૨) શ્રી કનેંચી મનલસ્કુમાર ઠક્કર (૩) શ્રીમતી પુશી મનલસ્કુમાર ઠક્કર (બામીનદાર) અને લ)મે. એમસ્લ્ડ વિઝન એલએલપી (ગિરવેદાર)	(રૂા. બે કરોડ બાવીસ લાખ નેવ્યાસી હજાર આઠસો છચાંસી અને નવ્વાણું પૈસા ફક્ત) તા. ૦૯.૦૬.૨૦૨૧	ફલેટ નં. દૃ૦૪, ક્ષેત્રફળ દૃર૭ સ્કે.ફુટ એટલે કે ૫૮.૨૫ સ્કે.મીટર્સ (કારપેટ એરીચા), છક્કે માળ, વણવહેચાચેલ અવિભાજીત જમીનમાં આવેલ હિસ્સા સાથેનું ક્ષેત્રફળ ૧૨.૬૩ સ્કે.મીટર્સ, "થશ પીંનેક્લ", ફાઈનલ પ્લોટ નં. ૨૭, ક્ષેત્રફળ ૪૬૫૪ સ્કે.મીટર્સ, ટાઉન પ્લાનીંગ સ્કીમ નં. ૨૨, મોજે : પાલડી, તાલુકો : સાબરમતી, સીટી અને જીલ્લો અમદાવાદ, ૨જીસ્ટ્રેશન સબ ડીસ્ટ્રીક્ટ અમદાવાદ – ૪ (પાલડી)	४२,५०,०००/-

💠 ઈ-હરાજાની તારીખ અને સમય : ૨૦.૦૫.૨૦૨૪. સવારે ૧૧:૦૦ થી બપોરે ૨:૦૦ (દરેક પ મિનીટના વધારા સાથે) ♣ બીડ મોક્લવાની છેલ્લી તારીખ : ૧૮.૦૫.૨૦૨૪ ♦ મિલકત નિરીક્ષણની તારીખ : ૧૦.૦૫.૨૦૨૪

વેચાણ માટેની વિગતવાર નિયમો અને શરતો જોવા મહેરબાની કરીને આપેલ લીંક https://www.vesbank.in/about-us/media/auction

property મુકરર લેણદાર ની વેબસાઈટ : www.yesbank.in અથવા https://sarfaesi.auctiontiger.net. જૂઓ. જો ટેન્ડર ડોક્યુમેન્ટસ ઈ-બીડીગ કેટલોગ મેળવવામાં અથવા સ્થાવર મિલકત મુકરર મિલકતની નિરીક્ષણમાં તકલીફ હોય અને કોઈ કવેરી હોય તો મહેરબાની કરીને થશ **બેંક લી. ના અધિકારીનો સંપર્ક કરવો, જય દવે, મો. હર**ેંડ **૫હેંહ અથવા ઇમેલ: jay.dave1@yesbank.in** અને મે. ઇ-પ્રોક્યુરમેન્ટ ટેક્નોલોજીસ લીમીટેડ (ઓક્સન ટાઈગર) અમદાવાદ, બીડર સપોર્ટ નંબરઃલ્ટકપપક્ટ૮૨૧, ૦૯૯-૬૧૨૦૦૫૯૪/૫૯૮/૫૬૮/૫૩૮, ઇમેલ : support@auctiontiger.net. નો સંપર્ક કરશો.

ઉદ્યારકર્તા / જામીનદારોને વેચાણ નોટીસ

ઉપરોક્ત સૂચના U/r તરીકે ગણવામાં આવશે. સિક્યોરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ ના ૯(૧), પ્રકાશન તારીખથી ૩૦ દિવસની અંદર તે ચૂકવવા માટે બંધાયે ારીખ : ૩૦.૦૪.૨૦૨૪, સહી/- અધિકૃત અધિક

જીએચસીએલ લિમિટેડ



(CIN: L24100GJ1983PLC006513) . ૨જી. ઓફીસ ઃ જીએચસીએલ હાઉસ, પંજાબી હોલ સામે, નવરંગપુરા, અમદાવાદ–૩૮૦૦૦૯.(ગુજરાત) Phone: 079-39324100

કોર્પોરેટ ઓફીસ : જીએચસીએલ હાઉસ, બી-૩૮, ઈન્ડસ્ટ્રીયલ એરીયા, સેકટર-૧, નોઈડા (યુપી). Phone: 0120-4939900 Email: ghclinfo@ghcl.co.in, secretarial@ghcl.co.in; Website: www.ghcl.co.in

કંપનીના ઈક્વિટી શેરધારકોને ધ્યાન દોરવા અંગેની નોટીસ

બાબત : કંપનીના ઈક્વિટી શેર ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેકશન ફંડમાં (આઈઈપીએફ) ફરજીયાત તબદીલ કરવા આથી આ કંપનીની શેરધારકોને નોટીસ આપી જણાવવાનું કે કંપની કાયદો ૨૦૧૩, ની કલમ ૧૨૪(૬) ની જોગવાઈ અનુસાર અને ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરીટી (એકાઉન્ટીંગ, ઓડીટ, ટ્રાન્સફર અને રીફંડ) રૂલ્સ, ૨૦૧૬ (ધ રૂલ્સ) સાથે વાંચતા તેમાં દર્શાવેલ જોગવાઈ અનુસાર કંપનીએ જે શેરદારકોએ સતંત સાત કે તેથી વધુ વર્ષો સુધી ડિવિડન્ડની રકમ જમા લીધી નથી કે તેના ઉપર દાવો કરેલ નથી તેઓના બધાજ શેરો કેંન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત આઇઇપીએફ એકાઉન્ટ ખાતે તબદીલ કરવાના રહેશે. આથી ઉપરોક્ત રૂલ્સની જોગવાઈઓ અનુસાર કંપની દ્ભારા એવા શેરધારકો કે જેમણે નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧७ (ફાઈનલ) થી લઈને સતત સાત કે તેથી વધુ વર્ષો સુધી ડિવિડન્ડની રકમ જમા <mark>લ</mark>ીધી નથી કે

તેના ઉપર દાવો કરેલ નથી તેમના શેર આઈઈપીએફ ઓથોરીટી ખાતે તબદીલ કરેલ છે. ઉપરોક્ત ૩૯સ મજબ કંપની દ્વારા લાગતા વળગતા બધા શેરધારકોને **તા. ૨૯મી એપ્રિલ, ૨૦૨૪** વ્યક્તિગત રીતે તેમના છેલા પ્રાપ્ત સરનામા ઉપર પત્ર વ્યવहાર કરેલ અને નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧७ થી શરૂ કરીને સતત સાત વર્ષ સધી ડિવિડન્ડનો દાવો નહીં કરનારા શેરધારકો કે જેમના શેરો આઇઈપીએક ખાતે તબદીલ થવાને લાયક હતા તેમને આવા શેરો માટે દાવો કરવા વિનંતી કરેલ હતી. કંપની દ્વારા દરેક શેરધારકો કે જેમના શેરોને આઇઇપીએફ ખાતે તબદીલ કરવાના છે તે દરેક શેરધારકો અને તેમના શેરોની વિગતો પણ કંપનીની વેબસાઈટ <u>www.ghcl.co.in</u> ઉપર અપલોડ કરેલ છે. આના સંદર્ભમાં. નીચેની વિગતો ધ્યાનમાં લેવા વિનંતિ

અ. જો શેરો ભૌતિક સ્વરૂપમાં ધારણ કરેલ હોય તો : ડ્પ્લીકેટ શેર સર્ટીફીકેટ જારી કરવામાં આવશે અને આઈઇપીએફ ઓથોરીટીના ડીમેટ એકાઉન્ટ ખાતે તબદીલ કરવામાં આવશે. આપના દ્વારા નોંધાચેલ અને આપે ધારણ કરેલ ઓરીજનલ શેર સર્ટીકીકેટ ઓટોમેટીકલી રદ ગણાશે અને તે નોન-વ્યવહારૂ માની લેવાશે.

બ. જો શેરો ઈલેક્ટોનીક સ્વરૂપમાં ધારણ કરેલ ઠોચ તો : આ શેરો આપના ડીમેટ એકાઉન્ટમાંથી કમી કરવામાં આવશે અને તે આઈઈપીએક ઓથોરીટીના ડીમેટ એકાઉન્ટ ખાતે તબદીલ કરવામાં આવશે.

આથી વધુમાં નોટીસ આપી જણાવવાનું કે શેરધારકો દ્વારા તા. **૧૫મી જુન, ૨૦૨૪** સુધીમાં માન્ય દાવાની પ્રાપ્તીના અભાવથી કંપની દ્વારા ઉપરોક્ત રૂલ્સની જરૂરીચાતની પૂર્તતા માટે આવા શેરોને વધુ કોઈ નોટીસ આપ્યા વગર આઈઈપીએફ એકાઉન્ટ ખાતે તબદીલ કરવામાં આવશે.

એની નોંધ લેશો કે દાવો નદીં કરવામાં આવેલ ડિવિડન્ડની રકમના સંદર્ભમાં કંપની સામે કોઈ દાવો કરી શકાશે નદીં અને ઉપરોક્ત રૂલ્સ મુજબ આ શેરોને આઈઈપીએફ ખાતે તબદીલ કરવામાં આવશે. શેર અને તેનું ડિવિડન્ડ આઈઈપીએફ ખાતે તબદીલ થયા પછી જો કોઈ શેરધારક ને તેનો દાવો કરવો હોય તો આઇઈપીએક ૩૯સ માં જણાવ્યા મજબ કોર્મ નં. IEPF-5 માં આઇઈપીએક ને અરજી કરવી. આ કોર્મ કંપનીની વેબસાઇટ અને

આઈઈપીએફ ની વેબસાઈટ <u>www.iepf.gov.in</u> ઉપર પણ ઉપલબ્ધ છે. શેરધારકોને ઉપરોક્ત બાબત અને તેના રૂલ્સ અંગે કોઈપણ જાતની સમસ્યા हોચ તો તે કંપનીના E-mail : <u>secretarial@ghcl.co.in</u> ઉપર સંપર્ક કરે અથવા કંપનીના રજીસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટનો સંપર્ક કરો. મે. લિંક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, ચુનિટ જીએેચસીએલ લિમિટેડ, સી-૧૦૧, ૨૪७ પાર્ક, એલબીએસ માર્ગ, વિખ્રોલી (પશ્ચિમ), મુંબઈ-૪૦૦૦૮૩. Tel. +91-022-8108116767, Fax: +91-022-49186060;

E-Mail: <u>iepf.shares@linkintime.co.in</u> જીએચસીએલ લિમિટેક વતી ભેતબૃક્ષક મિશ્રા તારીખ : ૨૯મી એપ્રિલ, ૨૦૨૪ વાઈસ પ્રેસિકેન્ટ - સસ્ટેનેબીલીટી અને કંપની સેક્રેટરી

Place : Mumbai

Date: 29.04.2024

SHIPPING CORPORATION OF INDIA LAND AND ASSETS LIMITED

Registered office: Shipping House, 245, Madame Cama Road, Nariman Point, Mumbai City, Mumbai, Maharashtra, India, 400021 Tel.: 91-022-2277 2220; Fax: 91-022-2202 6905; Email: cmdoffice@scilal.com CIN: U70109MH2021GOI371256; Web: www.scilal.com

(Amount in ₹ lakhs)

AUDITED FINANCIAL RESULTS FOR THE YEAR ENDING 31.03.2024

		STANDALONE				
Sr. No.	Particulars	Quarter ended 31.03.2024 (Audited)	Quarter ended 31.03.2023 (Audited)	Current Year ended 31.03.2024 (Audited)	Previous Year ended 31.03.2023 (Audited)	
1	Total income from Operations	396	278	1,722	1,250	
2	Net Profit / (Loss) for the period (Before tax, exceptional and/ or extraordinary items)		953	5,510	1,758	
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or extraordinary items)		953	5,510	1,758	
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or extraordinary items)	832	1,045	4,749	3,555	
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	832	1,045	4,749	3,555	
6	Equity Share Capital	46,580	46,580	46,580	46,580	
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance of the previous year	2,75,583	2,70,833	2,75,583	2,70,833	
8 Earnings Per Share (of ₹ 10 each) (for continuing and discontinued operations) (In ₹).						
	Basic:	0.18	0.22	1.02	0.76	
	Diluted:	0.18	0.22	1.02	0.76	

- a. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The Full format of the Quarterly/Annua Financial Results are available on the Stock Exchange websites. (www.bseindia.com and www.nseindia.com) Company's website: www.scilal.com
- Standalone Financial results for the quarter and year ended 31st March, 2024 are in compliance with Indian Accounting Standards (Ind-AS).
- The above audited financial results were reviewed and approved by the Board of Directors at their meeting held or 29th April, 2024.

The Board of Directors recommended a dividend of ₹ 0.66/- per equity share of face value of ₹ 10/- each. The outgo on this account will be approximately of ₹3074 lakhs, subject to the approval of members at the Annual General meeting.

For Shipping Corporation of India Land and Assets Limited

Capt. B.K.Tyagi Chairman & Managing Director DIN - 08966904



🚳 ∆લ∀૧૬ આવાસ ફાચનાન્સિચર્સ લીમીટેડ

(અગાઉ એચુ હાઉસીંગ ફાચનાન્સ લીમીટેક તરીકે જાણીતી) (CIN:L6592RJ2011PLC034297) રજી. અને કોર્પો. ઓફીસ : ૨૦૧–૨૦૨, બીજો માળ, સાઉથ એન્ડ સ્ક્વેર, માનસરોવર ઇન્ડસ્ટ્રીયલ એરિયા, જ્યપુર–૩૦૨૦૨૦

કબજા નોટીસ જત જણાવવાનું કે નીચે સહી કરનાર **આવાસ ફાયનાન્સિયર્સ લીમીટેડ (અગાઉ ''એયુ હાઉસીંગ ફાયનાન્સ લીમીટેડ તરીકે જાણીતી'')** ના અદિાકૃત અધિકારીએ સિક્ચોરિટાઇપ્રેશન અને રિકન્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ,૨૦૦૨ હેઠળ અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૯ સાથે વંચાતી કલમ ૧૩(૧૨) હેઠળ મને મળેલ સત્તાનો ઉપયોગ કરીને જણાવેલ નોટીસની બજવણીની તારીખથી ૬૦ દિવસની અંદર સબંધિત નોટીસમાં નીચે જણાવલે રકમ ચુકવી જવા દેવાદારોને માંગણાં નોટીસ પાઠવી હતી. દેવાદારો રકમની પરત ચુકવણી કરવામાં નિષ્ફળ જતાં જણાવેલ નિયમોના નિયમ ૯ સાથે વંચાતી જણાવેલ કાયદાની કલમ ૧૩(૪) હેઠળ મળેલી સત્તાની રૂએ નીચે જણાવેલે મિલકતોનો કબજો નીચે જણાવેલ તારીખોએ લઇ લીધો છે. ખાસ કરીને દેવાદારો અને જામીનદારોને અને જાહેર જનતાને અહી સાવધ કરવામાં આવે છે કે મિલકતો સાથે કોઇ વ્યવહાર કરવો નહી અને મિલકત સાથેનો કોઇપણ વ્યવહાર **આવાસ ફાયનાન્સિયર્સ લીમીટેડ (અગાઉ ''એયું હાઉસીંગ ફાયનાન્સ લીમીટેડ તરીકે જાણીતી'')** ના અહીં નીચે જણાવેલ રકમ અને તેના પરનાં ચડત વ્યાજને આધિન રહેશે.

દેવાદારનું નામ	માંગણા નાટાસના તારીખ અને રકમ	મિલકતની વિગત	કબજા નાટાસના તારીખ અને પ્રકાર			
પરાગકુમાર રામચંદ્ર દવે, શ્રીમતી જાગૃત્તિએન પરાગકુમાર દવે (A/c No.) LNBRD04319-200121106 જામીનદાર : શ્રીમતી માચાદેવી એમ. ગોરવામી (A/c No.) LNBRD02918-190085569	૧૯–૦૨–૨૪ રૂા. ૨૯૩૫૨૪/– અને રૂા. ૫૭૭૬૨૦/– ૧૯–૦૨–૨૪ મુજબ	મુકામ–ફ્લેટ નં. ૦૨, રામપ્રસાદ એપાર્ટમેન્ટ, જમીનનો ટિક્કા નં. ૧૫/૫, સિટી સર્વે નં. ૭/૧/એ, ૭/૧એ, ૭/૧સી, લાધારામ હાઇ સ્કુલ પાસે, ફ્લેહપુરા, વડોદરા, ગુજરાત ખાતેની રેસિડેન્શીચલ મિલકત. ક્ષેત્રકળ પદ૦ ચો. ફટ	ર૭–૦૪–૨૪ નાં રોજ સાંકેતિક કબજો લીધો			
પ્રશાંત અરવિંદભાઇ કાકડિયા, શ્રીમતી અંકિતા પ્રશાંત કાકડિયા, જામીનદાર : શ્રી આકાશ નાગજીભાઇ વદાસિયા (A/c No.) LNSUR01417-180055123 & LNSUR00317-180055148	૧૯–૦૨–૨૪ રૂા. ૬૪૦૩૦૭/– અને રૂા. ૬૯૩૮૯૨/– ૧૯–૦૨–૨૪ મુજબ	ફ્લેટ નં. પ૦૫, પાંચમો માળ, 'કામદો નું રેસિડેન્સી', રાજ્ય-ગુજરાત, જિલો-સુરત, તાલુકો-ઓલપાડ, મોજે-ડિલાડ, બ્લોક નં. ૧૨૩ પૈકી પ્લોટ નં. ૪૦, ૪૧ અને ૪૨, પીન-૩૯૫૦૦૯ ખાતેની રેસિડેન્સીચલ મિલકતની પ્રીમાઇન્સીસ. ક્ષેત્રફળ દૃ૧૬,૦૦ ચો. ફૂટ સુવ સેત્રફળ ૧૬૬,૯૦ ચો. મેટ કુલ ક્ષેત્રફળ ૧૬૬,૯૦ ચો. મી. ફ્લેટ નં. ૫૦૧, પાંચમો માળ, 'કામદો નું રેસિડેન્સી', રાજ્ય-ગુજરાત, જિલો-સુરત, તાલુકો-ઓલપાડ, મોજે-ડિલાડ, બ્લોક નં. ૧૨૩ પૈકી પ્લીટ નં. ૪૦, ૪૧ અને ૪૨, પીન-૩૯૫૦૦૯ ખાતેની રેસિડેન્સીચલ મિલકતની પ્રીમાઇન્સીસ. ક્ષેત્રફળ પઠ છતો. કુટ સુધ ક્ષેત્રફળ પઠ અહેરિયા ૩૫૦.૪૦ ચો. ફૂટ સુધ ક્ષેત્રફળ ૧૬૬.૯૦ ચો.મી.	ર૭–૦૪–૨૪ નાં રોજ સાંકેતિક કબજો લીધો			
રથળ : જ્યપુર તારીખ : ૩૦-૦૪-૨૦૨૪ અધિકૃત અધિકારી આવાસ ફાયનાન્સિયર્સ લીમી						

яa,

हेवाहार

આદરણિય મહોદય

केनरा बैंक Canara Bank 📣 र् सिडिकेट Syndicate

વિઝોલ ખાતે . અમદાવાદ ૩૮૨૪૪૫

वस्त्रापुर शामा (०७६-२५७५४३३४) હિંડોળા કોમ્પ્લેક્સ, નહેરુ પાર્ક વસ્ત્રાપુર, માણેકબાગ સોસાયટી, એસ.ઓ., અમદાવાદ-3૮૦૦૧૫

દેવાદાર/જામીનદાર/ગીરોદારને (ક્લમ ૧૩ (૨)) હેઠળ માંગણા નોટિસ તારીખ : ૨૨/૦૪/૨૦૨૪ Ref: AHD/RO/DIPAK/RL

શ્રી દિપક્કુમાર નરેશભાઈ અગ્રવાલ, પુત્ર શ્રી નરેશભાઈ અગ્રવાલ સી-૨/૫૬, બ્લોક નં.૫૬૦, અમરાઇવાડી મેટ્રો સ્ટેશન પિલર નંબર ૫૫ પાસે, રામનગર ભીલવાડા, અમરાઇવાડી अभहावाह ३८००२६ ફ્લેટ નં.૬૦૭, છઠ્ઠો માળ , રાધે ઓમ સિટી ,વિંઝોલ રેલવે બ્રિજ પાસે હાથીજણથી અસલાલી ૨૦૦ ફૂટ , એસપી રિંગ રોડ ,

विषय : शिक्योरीहार्धजेशन એन्ड रिक्क्ट्रेडशन ओक् कार्चनान्त्रियव એसेट्स એन्ड એन्क्रोरीमेन्ट ओक् शिक्योरीही र्घन्टरेस्ट એક्ट, ૨૦૦૨ ની કલમ ૧૩ (૨) હેઠળ ડિમાન્ડ નોટીસ.

આપે અમારી **વરત્રાપુર શાખા** પાસેથી, વખતો વખત નીચે મુજબની લોન્સ/ક્રેડિટ સુવિધાઓ મેળવી હતી.

અ. નં.		લોન / મર્ચાદાનો પ્ રક ાર	તા.૨૧/૦૪/૨૦૨૪ મુજબ મુદ્દલ ૨ ૭ મ	તા.૨૧/૦૪/૨૦૨૪ થી આગામી વ્યાજ અને ચાર્જીસ	તા. ૨૧/૦૪/૨૦૨૪ મુજબ કુ લ જવાબદારી	વ્યાજનો દર
1	160001163741	Housing Loan	રૂા. 13,88,706.3	इ।. 47,471.00	ড়৷. 14,36,177.30	11.50% (@ ૨% ના દરે પેનલ વ્યાજ સહિત)

ઉપરોક્ત લોન્સ/ક્રેડિટ સુવિદ્યાઓને નીચે ચાદીમાં વિગતવાર જણાવેલ મિલકત ગીરો કરાવીને આપના દ્વારા અમારી તરફેણમાં સંબંધિત યોગ્ય દસ્તાવેજોની કાર્યવાહી કરીને સુરક્ષિત કરવામાં આવી હતી. આપ જણાવેલ શરતો અને નિયમો અનુસાર નાણાં ચૂકવવામાં નિષ્ફળ ગયા હોવાથી બેંકે **તા. ૨૦/૦૪/૨૦૨૪ ના રોજ** આપના ખાતાને **એનપીએ** તરીકે જાહેર કર્યું હતું. આથી અમે આ કાયદાની કલમ ૧૩(૨) હેઠળ **લાઉસિંગ લોનમાં તા. ૨૧/૦૪/૨૦૨૪ ના રોજ રૂ. ૧૪,૩૬,૧૯૭.૩૦ (રૂપિયા ચૌદ લાખ છત્રીસ હજાર એક્સો રિલ્યોતેર પૈસા ત્રીસ ફક્ત) ની** સંપૂર્ણ જવાબદારી ૨૨/૦૪/૨૦૨૪ થી વધુ વ્યાજ અને ચાર્જીસ સાથે મળીને ચાર્જીસ સાથે + વધુ વ્યાજ અને તેના પરના ચાર્જ, સાથે મળીને, ં આ નોટીસની તારીખથી ૬૦ દિવસની અંદર ચૂકતે કરી જવો. જેમાં કસૂર થવા પર બેંક કથિત એક્ટની કલમ ૧૩(૪) હેઠળના કોઇપણ અથવા તમામ અધિકારનો ઉપયોગ કરશે.

ઉપરાંત , આપને બેંકની પૂર્વ મંજૂરી રિવાય શિડ્યુલમાં જણાવેલ સુરક્ષિત મિલકતનો કોઇપણ રીતે ઉપયોગ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવે છે. આ અમને કથિત એક્ટ દ્વારા ઉપલબ્ધ અને/અથવા પ્રવર્તમાન અન્ય કોઇપણ એક્ટ દ્વારા ઉપલબ્ધ કોઇપણ અન્ય અધિકારના પૂર્વગ્રહ સુરક્ષિત મિલકત છોડાવવા માટે ઉપલબ્ધ સમય અંગે સરફેસી એક્ટની કલમ ૧૩ ની પેટા-કલમ (૮) ની જોગવાઈઓ પ્રત્યે અમે આપનું

દ્યાન દોરીએ છીએ આપને આ ડિમાન્ડ નોટીસ શાખામાં ઉપલબ્ધ આપના છેલ્લા સરનામે રજાસ્ટર્ડ પોસ્ટ એ ડી. દ્વારા મોક્લવામાં આવી છે.

561	पर भिલકતનी વिગતો	
행. 히.	SIGK	शहरल हाड्डना गाम
9	રથાવર મિલકતના તમામ પીસ અને પાર્સલ ધારક ફ્લેટ નં. એફ/ફ્૦૭ દૂકા માળે, બાંધકામ આશરે ૪૪.૫૫ ચો.મી. કાર્પેટ એરિયા ૨.૪૬ ચો.મી., વોશ એરિયા ૧.૪૪ ચો.મી., બાલ્કની એરિયા, જમીનમા અવિભાજય મમાણસર હિસ્સો અાશરે ૨૨.૯૦ ચો.મી. સ્કીમ જાણીતી રાધે એમ સિટી આવેલ છે એન.એ. જમીન ૧૦૨૦૨ ચો.મી. રહેણાક હેતુસર અને ૨૦૦૦ ચો.મી. કોમશિયલ હેતુસર સહિત તમામ ૧૨૨૦૨ ચો.મી. પૈકી ૧૧૨૧૨ ચો.મી. સબ પ્લોટ નં.૧ અને ૨ જેનો ફાઇનલ પ્લોટ નં.૧૧ (સર્વે નં. ૨૧૩, ૨૦૩૩૬ ચો.મી. ના બદલે) જેની ટી.પી.સ્કીમ ૧૨૭ મોજે ગામ- વિંઝોલ, તાલુકો- વટવા રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અપ ડિસ્ટ્રીક્ટ અમદાવાદ અને સબ રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદ અને સબ રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદ ન૧ (અસલાલી) અને ચતુર્સિમા નીચે મુજબ છે. પૂર્વ- સીડી, પશ્ચિમ- સોસાયટીનો બગીચો, ઉત્તર- સોસાયટી રોડ, દક્ષિણ- ફલેટ નં. એફ/ફ્૦૬.	શ્રી દિત ર ુટ્ટિમાર વર્ડકાભાઇ અગ્રેવાલ

नोध : विवाहनी खितिमां संग्रेल लायुचिमां प्रकाशित बबेब नोटीय मान्य ग्रहाशे. તારીખ : ૨૨.૦૪.૨૦૨૪, સ્થળ : અમદાવાદ

RELIANCE

NOTICE TO THE MEMBERS

Members are hereby informed that pursuant to the provisions of Sections 108 and 110 of the Companies Act 2013 (the 'Act'), read with the Rules made thereunder, as amended, from time to time and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, read with the relevant circulars issued by the Ministry of Corporate Affairs ("MCA") (hereinafter collectively referred to as "MCA Circulars") the Company has sent Postal Ballot Notice along with the explanatory statement thereto ('Postal Ballot Notice') with respect to the special business mentioned therein and the Postal Ballot Form to the members of the Company, on Monday, April 29, 2024.

In compliance with the aforesaid MCA Circulars, Postal Ballot Notice is being sent only through electronic mode to those Members whose e-mail addresses are registered with the Company / Depositories.

The Postal Ballot Notice along with the Postal Ballot Form containing the process and instructions was sent to all the members, whose names appear in the Register of Members / list of beneficial owners as received from National Securities Depository Limited ("NSDL") / Central Depository Services (India) Limited ("CDSL") as on Friday, March 29, 2024 ('Cut-Off Date'), for seeking their approval through Postal Ballot

E-voting facility is provided to the members to enable them to cast their votes electronically. The Company has engaged the services of KFin Technologies Limited ('KFIN'), Registrar and Transfer Agent of the Company, for providing e-voting facility.

Members whose e-mail address is not registered can register the same in the following manner:

Members holding share(s) in physical mode can register their e-mail ID on the Company's website at www.reliancehomefinance.com by providing the requisite details of their holdings and documents for

Members holding share(s) in electronic mode are requested to register / update their e-mail address with their

respective Depository Participants "DPs" for receiving all communications from the Company electronically. Members whose names appear in the register of members of the Company or in the register of beneficial owners maintained by the depositories as on the Cut-Off Date, i.e., Friday, March 29, 2024 only shall be entitled to cast

their votes by way of Postal Ballot or e-voting. A person who was not a Member of the Company on Cut-Off date should treat the Postal Ballot Notice for information purpose only. Members may vote on the postal ballot from April 30, 2024 to May 29, 2024. In terms of the requirements of SEBI Circular No.: SEBI/HO/CFD/CMD/CIR/P/2020/242 dated December 9, 2020, the e-voting period

begins at 10:00 A.M. (IST) on Tuesday, April 30, 2024 and ends at 5:00 P.M. (IST) on Wednesday, May 29, 2024. Thereafter the e-voting module shall be disabled by KFIN. In case of voting through physical mode postal ballot forms received after 5:00 P.M. (IST) on Wednesday, May 29, 2024 shall be considered as invalid. In case of non-receipt of the Postal Ballot Form or for request for a duplicate Postal Ballot Form or for any other

query or grievances pertaining to voting by Postal Ballot, including the e-voting process can be addressed to the Company Secretary through e-mail at rhfl.investor@relianceada.com OR Mr. Praveen Chaturvedi. Vice President KFin Technologies Limited, Selenium Building, Tower-B, Plot No. 31 & 32, Financial District, Nanakramguda, Hyderabad, Telangana 500 032 OR contact toll free no.1800 309 4001 OR visit Help and FAQs and e-voting user manual available at the download section of KFintech's website at https://evoting.kfintech.com Mr. Anil Lohia, Partner or in his absence Mr. Khushit Jain, Partner, M/s. Dayal and Lohia, Chartered Accountants

have been appointed as the Scrutinizer for conducting the Postal Ballot voting process in a fair and transparen The results of the Postal Ballot and e-voting will be declared on or before 5.00 P.M. (IST) on Friday, May 31, 2024 at the Registered Office of the Company by placing it along with the report of the scrutinizer on its notice board, Company's website www.reliancehomefinance.com and shall also be communicated to the Stock

The Postal Ballot Notice and Postal Ballot Form are available on the Company's website www.reliancehomefinance.com, websites of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively, and on KFIN's website www.evoting.kfintech.com

For Reliance Home Finance Limite

Krutika Gada Company Secretary & Compliance Officer

April 29, 2024 Reliance Home Finance Limited

Mumbai

CIN: L67190MH2008PLC183216 Registered Office: Trade World, Kamala Mills Compound

Exchanges where the equity shares of the Company are listed.

7th Floor, B Wing, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai 400 013

Tel.: +91 22 4158 4000, E-mail: rhfl.investor@relianceada.com, Website: www.reliancehomefinance.com

QUICKLY.

Yen surges against dollar amid official intervention



The yen jumped against the dollar on Monday, with traders citing yen-buying intervention by Japanese authorities as a trigger for the bounce in a currency languishing at levels last seen over three decades ago. The dollar tumbled to a low of ¥154.40 from as high as 160.245 earlier in the day. Banking sources said

India (RBI) announced the launch of the 'inflation expectations survey of households' and 'consumer confidence survey' which will provide key inputs for the bi-monthly monetary policy. The next bi-monthly monetary policy is scheduled for June

G Balachandar

Shriram General Insurance

Company has outlined its fiveyear growth plan, aiming to

towns and rural areas to target

Shriram Group and Sanlam

Group achieved record per-

formance in FY24, with a 34

per cent growth in gross direct

totalling ₹3,036 crore. This

marked the best fiscal year in

the past 15 years, maintaining

a trend of outpacing industry

During FY23, the non-life

industry grew by 16.4 per cent,

by 29 per cent. In FY24, Shri-

growth and profitability.

wniie Shriram General

underwritten,

The joint venture between

the uninsured population.

Private banks end on a strong note with healthy Q4 numbers

LOOKING AHEAD. To focus on holding on to margins, improving profitability in FY25

Anshika Kayastha

Private banks closed FY24 on a strong note with healthy Q4 earnings across the board led by strong loan growth and a pick up in deposit growth.

led largely by retail, unsecured and small and mid-corporate segments. While capex growth continued to be led by PSUs and government spending, some mid and large banks were optimistic about some signs of a pick up in private capex going into FY25.

mentum is expected to sustain to an extent, some large banks such as Axis Bank and HDFC Bank also cautioned that combined with higher risk weights, the pressure on deposit accretion could lead to some amount of moderation in loan growth in the coming quarters. Further, given elevated lending rates, more corporates are choosing to raise funds from the market as against taking bank loans which could lead to higher op-

To grow share of non-motor business to 15%,



GOOD SHOW. Yes Bank was the outlier seeing an improvement in margins both on year and sequentially, with the bank saying

portunities for banks in the capital market segments instead of pure corporate term loans, they

for most banks on the back of the elevated cost of funds due to the push for deposit mobilisation. In the earnings call, the management of banks guided that margins are likely to remain weighed down for at least 1-2 quarters before normalising, supported by an expectation of easing in lending rates in the second half of the financial year. Yes Bank was the outlier seeing an improvement in margins both on year and sequentially, with the bank saying that

it expects margins to improve

What weighed on the bottomline for most banks during the quarter and FY24 was higher operating costs due to investments in technology and digital upgradation and wages or employee incentives given the high attrition rate across the sector. As a result, in addition to strengthening the deposit base and holding onto margins, maintaining and improving profitability ratios are key focus areas for banks going into the new fiscal year.

Slippages during Q4 were

largely from the retail portfolio, in line with the loan growth in the segment, whereas corporate slippages improved for most lenders, especially in unsecured personal loans and credit cards. Due to the higher risk weights imposed by the regulator and elevated slippages, banks such as ICICI Bank said that they are continuously monitoring and recalibrating the retail portfolio based on risk parameters such as ticket size, credit scores and lines of credit, among others. Most other banks also highlighted that a majority of their unsecured book is to existing customers and remains a small portion of total loans.

Smaller private banks such as RBL Bank and DCB Bank said that while they were slower to emerge from the Covid pandemic impact due to the high exposure to rural, semi-urban and self-employed borrowers, the trend has started reversing and recoveries and collections from these segments have improved significantly, leading to an improvement in asset quality ratios for most lenders.

Press Trust of India

and lenders resorting to unfair practices in charging of interest, the RBI directed regulated entities (REs) since 2003, inter-alia, advocate fairness and transparency in charging of interest by the lenders while providing ad-

RBI asks lenders to refund excess charges, ensure

equate freedom to them as re-

Rise in currency in circulation reflects strong economic performance: Report

Currency in circulation

K Ram Kumar

The steady rise in currency in circulation (CIC) at 15 per cent compounded annual growth rate (CAGR) in seven years (FY17-FY24) reflects a strong economic performance and signals a boom cycle, according to CMS' Consumption Report for 2024.

While UPI was launched in 2016 (FY17) to promote digital payment transactions, CIC increased from ₹13.35-lakh crore in FY17 to ₹35-lakh crore in FY24, nearly three times the growth in 7 years, per the report. The amount of CIC is re-

lated to the use of cash as a payment instrument since one of the major forces of demand for currency is its use for making payments, according to a February 2020 RBI study.

The report said the CMS Cash Index (CCI) and the HSBC India Composite Purchasing Managers Index (HSBC ICPMI) have exhibited a strong correlation since April 2016 while indicating how cash usage is closely linked to economic growth and consumption in a country.

CCI is a weighted index consisting of two factors: the cash that goes into circulation via the ATM channels as replenishment and the cash collected from organised retail channels after consumer purchases.

HSBC ICPMI gauges the economy's through the expansion and contraction of economic activity.

"Smaller economies such

percentage of their GDP) when compared to the larger economies such as the US, China, Japan and India, thereby indicating the direct correlation between CIC and the size of the economy," CMS said. ATM WITHDRAWAL

In FY24, 14 out of 23 States and Union Territories

(UTs) witnessed 6.45 per cent year-on-year (y-o-y) growth in the annual average ATM withdrawal, while nine states and UTs saw an average 4.14 per cent decline, per the report.

The monthly average ATM cash withdrawals (used as a proxy for consumption spending) grew 5.51 per cent to ₹1.43 crore in FY24 from ₹1.35 crore in

In terms of absolute withdrawal Karnataka saw the highest annual average withdrawal of ₹1.83 crore during FY24, followed by Delhi (₹1.82 crore) and West Bengal (₹1.62 crore).

Every month, the average ATM cash withdrawals in FY24 were higher compared to FY23, with withdrawals in 10 out of 12

CMS said a deeper analysis of ATM cash withdrawals leads to the emergence of two major consumption trends - consumption is reaching the grassroots even as metros continue to hold sway, and five major hotspots (Delhi, Uttar Pradesh, Tamil Nadu, Karnataka and Bengal) of consumption spending.

"For an economy to flourish, it is imperative that the payments ecosystem allows all modes of transactions. Cash payments are an indispensable complement to mobile, electronic, and other forms of digital payments.

"This balance is especially vital for a consumption-driven economy like India, where the ability to spend influences overall economic health," the report said.

The report assessed that the top five retail sectors with highgrowth in consumption in FY24 were: media & entertainment (M&E), FMCG, railway, aviation, and durables.

In FY23, the top five retail sectors with high consumption growth were petroleum, media entertainment, railway, aviation, and footwear.

strength from 69,000 to about grow the share of the non-mocent in FY24 tor business from 8.5 per cent 2 lakh in five years. It plans to them to take corrective acas Brazil, South Africa, Rusmonths exceeding the FY23 add about 20,000 agents in tion and refund excess sia and the UK had d much monthly average of 7.23 per now to 15 per cent while in-ANIL AGGARWAL charges to customers. The lower volumes of CIC (as a creasing the number of agents FY25, particularly focusing on MD and CEO. guidelines on the Fair Pracfrom 69,000 to 2 lakh. The exsmall towns and rural areas. pansion strategy includes Aggarwal said the company tices Code issued to various UCO Bank to inject capital; at ₹526 cr, deeper penetration into small was also looking at driving

Press Trust of India

UCO Bank said that its board has approved the issuance of fresh equity shares with a face value of ₹4,000 crore in the current fiscal year. The bank also reported a standalone net profit of ₹525.77 crore for

March 2024, a decrease of 9.5 per cent compared to the corresponding period last year.

Q4 standalone net down 9.5%

Subject to shareholder approval, the lender will explore various methods like QIP Institutional (Oualified Placement), FPO (Follow-on Public Offer), etc, for issuing 400 crore equity shares of ₹10 each, the bank informed bourses. This issuance may

occur in multiple tranches during FY25. The capital infusion is expected to support the bank's growth plans.

UCO Bank's total income for the quarter grew by 17.44 per cent to ₹6,984.61 crore. The bank also witnessed an improvement in asset quality, with gross NPA falling to 3.46 per cent compared to 4.78 per

PNB Housing Finance Q4 net up 57%

ance

businessline.

KR Srivats New Delhi

PNB Housing Finance Ltd (PNBHFL) on Monday reported a 57.27 per cent increase in consolidated net profit for the quarter ended March 31, 2024 at ₹439.25 crore (₹279.28 crore).

In the December 2023 quarter, consolidated net profit stood at ₹338.44 crore. Total income for the quarter

under review increased 11 per cent to ₹1813.97 crore (₹1637.72 crore). PNBHFL had recorded a total income of ₹1756 crore in the December 2023 quarter.

SURGE IN PROFIT

For the entire fiscal 2023-24. PNBHFL has recorded a 44 per cent increase in consolidated net profit at ₹1,508.01 crore ($\mathbf{1.046}$ crore).

financial performance, Gir-

ish Kousgi, MD and CEO, PNBHFL, said: "During the financial year 2023-24, the company made significant progress across various business and financial parameters. The completion of a successful fund raise via rights issue underscores the confidence of our shareholders.

expansion and increased

agent and financial advisor re-

cruitment. It expects 30 per

cent growth in the current

In FY24, the share of motor

business came down to 91.5

per cent from 92 per cent in

FY23. Over five years, the

company expects the motor

share to come down further to

more branches in non-metro

locations. Its current network

It will continue to open

85 per cent in five years.

fiscal year as well.

EXPANSION PLANS

He also said PNBHFL has witnessed a remarkable improvement in the asset quality, which reduced by 57 per

JAI BALAJI INDUSTRIES LIMITED Registered Office: 5, Bentinck Street, Kolkata-700 001

the fourth quarter ended

Phone: (033) 2248-9808, Fax: (033) 2243-0021

Email: jaibalaji@jaibalajigroup.com, Website: www.jaibalajigroup.com, CIN: L27102WB1999PLC089755

EXTRACT OF STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2024

(₹in Lakhs)

SI.	Particulars	Standalone				Consolidated			
No.			Quarter Ended Year ended			Quarter Ended		Year	
		31.03.2024 (Audited)	31.12.2023 (Unaudited)	31.03.2023 (Audited)	31.03.2024 (Audited)	31.03.2023 (Audited)	31.03.2024 (Audited)	31.12.2023 (Unaudited)	ended 31.03.2024 (Audited)
	Total income from operations Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	200,183.15 35,662.58		174,524.63 3,401.37	662,886.69 96,321.10	616,056.41 10,492.15	200,183.15 35,662.58	156,242.68 23,460.29	662,886.69 96,321.10
	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	35,662.58	·	3,401.37	96,321.10	10,492.15	35,662.58	23,460.29	96,321.10
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	27,297.94	23,460.29	(1,308.34)	87,956.46	5,782.44	27,297.94	23,460.29	87,956.46
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	27,216.45	23,460.29	(1,346.60)	87,874.97	5,744.18	27,216.45	23,460.29	87,874.97
7	Equity Share Capital Other Equity Earnings Per Share (EPS) (of ₹ 10/- each) (not annualised)	16,365.03	16,045.03 -	14,545.03	16,365.03 134,046.60	14,545.03 41,062.71	16,365.03	16,045.03 -	16,365.03 134,046.60
	(a) Basic (in ₹) (b) Diluted (in ₹)	16.95 15.77	14.72 13.22	(1.26) (0.73)	55.80 49.82	4.49 4.11	16.95 15.77	14.72 13.22	55.80 49.82

NOTE:

- a) The above is an extract of the detailed format of Annual Financial Results filed with the Stock Exchanges for the quarter and year ended 31st March, 2024 under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Annual Financial Results for the fourth quarter and year ended 31st March, 2024 are available on the Stock Exchange websites viz. www.nseindia.com, www.bseindia.com and on the
- b) The figures for the quarter ended March 31, 2024 represents the derived figures between the audited figures in respect of the full financial year ended March 31, 2024 and the unaudited published period to date figures upto December 31, 2023 being the date of the third guarter of the current nine months period. which were adjusted to a limited review.
- c) The above Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 25.04.2024.
- d) Previous year figures have been re-grouped /re-arranged whereever necessary, to make them comparable.

FOR JAI BALAJI INDUSTRIES LIMITED

Aditya Jajodia **Chairman and Managing Director** DIN: 00045114

Place: Kolkata Sd/- Bhuwneshwar Mishra Date: 25th April, 2024

Place: Noida Date: April 29, 2024

Japanese banks were seen selling dollars for yen. REUTERS **RBI launches surveys for** monetary policy inputs Mumbai: The Reserve Bank of

Loan growth continued to be

While deposit growth mo-

Our market share

has also gone up

from 0.88 per cent

in FY23 to 1.05 per

ram's growth outpaced the in-

dustry with a 34 per cent in-

crease, while the industry

grew by 13 per cent. "Our mar-

ket share has also gone up

from 0.88 per cent in FY23 to

1.05 per cent in FY24. While

the motor business grew by 33

per cent, the non-motor busi-

ness recorded a 43 per cent in-

crease in FY24," Anil Aggar-

CEO, Shriram General Insur-

Company,

The company credited its

record performance to branch

told



that it expects margins to improve further REUTERS

Margins were flat-to-lower

KEY FOCUS AREA

ning to add 25 branches in this

With agents as a major busi-

ness contributor, the com-

pany aims to increase its

growth in its new business

areas. It is aggressively focus-

sing on the electric autorick-

shaw segment, which has re-

corded 150 per cent growth in

FY24, while it is targeting elec-

tric two-wheelers and electric

cars too. As the health seg-

ment has seen strong traction

in the post-Covid period, the

company said it has already

taken baby steps in the seg-

ment with the launch of bene-

fit health products covering

critical illnesses. However, it


nas yet to enter the indemnity

health product segment.

Shriram General Insurance charts 5-year plan fair practices includes 276 branches, up from 235 in FY23. It is plan-

Concerned over some banks

gards loan pricing policy. "During the onsite examination of REs for the period ended March 31, 2023, the RBI came across instances of lenders resorting to certain unfair practices in charging of interest," the RBI said in a circular. The central bank has also highlighted certain unby certain lenders.



Commenting on the latest

(CIN: L24100GJ1983PLC006513) Regd. Off.: GHCL House, Opp. Punjabi Hall, Navrangpura, Ahmedabad-380009. (Gujarat) Ph. 079-39324100 Corporate Office: GHCL House, B-38, Institutional Area, Sector-1, Noida (UP) Ph. 0120-4939900 Email: ghclinfo@ghcl.co.in, secretarial@ghcl.co.in Website: www.ghcl.co.in

NOTICE - (FOR THE ATTENTION OF EQUITY SHAREHOLDERS OF THE COMPANY) SUB.: MANDATORY TRANSFER OF EQUITY SHARES OF THE COMPANY TO INVESTOR EDUCATION AND PROTECTION FUND (IEPF) Notice is hereby given to the Shareholders of the Company pursuant to the provisions of Section 124(6) of the

Companies Act, 2013 read with Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("the Rules") that the Company is required to transfer the shares in respect of which dividend remains unpaid or unclaimed for a period of seven consecutive years, to the IEPF Account established by the Central Government. Hence, all the underlying Equity Shares in respect of which dividend has not been paid or claimed for last seven consecutive years from the financial year 2016-17 (Final), have to be transferred to the IEPF Authority as

As per the said Rules, the Company had sent a communication dated April 29, 2024 to the concerned shareholders individually at their latest available address, who did not claimed the Dividends for seven consecutive years starting from financial year 2016-17 and whose shares were liable to be transferred to IEPF, requesting them to claim the same. The Company had also uploaded the details of the shareholders whose shares were liable to be transferred to IEPF on its website viz., www.ghcl.co.in.

In this connection, please note the following: a. In case of shares held in physical form: Duplicate share certificate(s) will be issued and transferred to the Demat Account of the IEPF Authority. The original share certificate(s) registered in your name and held by you will stand automatically cancelled and be deemed non-negotiable.

b. In case of shares held in electronic form: The shares shall be debited to your Demat account and will be transferred to IEPF's Demat account. Notice is hereby further given that in absence of receipt of a valid claim by the shareholders till June 15, 2024 the Company will transfer said shares to IEPF Account without further notice in accordance with the requirement of

Please note that no claim shall lie against the Company in respect of the unclaimed Dividend amount and shares transferred to IEPF pursuant to the said Rules. On transfer of the Dividend and the shares to IEPF, the Shareholders may claim the same by making an application to IEPF in Form IEPF-5 as per the IEPF Rules. The said form is available on the Company's website and website of IEPF viz., www.iepf.gov.in. In case the shareholders have any queries on the subject matter and the Rules, they may contact to the Company

(E-mail: secretarial@ghcl.co.in) or to the Company's Registrar and Share Transfer Agents, M/s Link Intime India Pvt Ltd., Unit - GHCL Limited, C-101, 247 Park, L.B.S. Marg, Vikhroli (West), Mumbai - 400 083. Tel. +91-022-8108116767 Fax: +91-022-49186060; E-Mail: iepf.shares@linkintime.co.in For GHCL Limited

VP-Sustainability & Company Secretary